



ગુજરાત સરકાર

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજીત
સુરત મહાનગર પાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર અમલીકરણ
સમિતિ દ્વારા સંચાલીત
ખેલ મહાકુંભ-૨૦૨૫



સુરત શહેર અને ગ્રામ્યકક્ષા પરિપત્ર

સંચાલન

જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સુરત

પેહલો માળ સુડાભવન વેસુ આભવા રોડ,

વેસુ, સુરત. ૩૯૫૦૦૭

સુરત ફોન નં- ૦૨૬૧-૨૯૯૦૯૫૦

Email- dsdo-surat@gujarat.gov.in

જા.ક્રમાંક:- ડી.એસ.સી.સી./૨૫૦૨ થી ૩૦૦૨ / ૨૦૨૫-૬

જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સુરત,

પેહલો માળ, વેસુ આલવા રોડ,

વેસુ, સુરત. ૩૯૫૦૦૭

Email - dsdo-surat@gujarat.gov.in

તા.૨૨/૦૯/૨૦૨૫

પ્રતિ,

૧. આચાર્યશ્રી, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તમામ, સુરત શહેર અને સુરત ગ્રામ્ય
૨. આચાર્યશ્રી, તમામ કોલેજો તથા શૈક્ષણિક સંસ્થાઓ તમામ, સુરત શહેર સુરત ગ્રામ્ય

વિષય - ખેલ મહાકુંભ-૨૦૨૫ શાળાકક્ષા સ્પર્ધાના કાર્યક્રમ બાબત.

સંદર્ભ - એસ.એ.જી, ગાંધીનગરના પત્ર ક્રમાંક- એસ.એ.જી/ખેમકું ૨૦૨૫/૨૦૨૫-૨૬

તા.૨૬/૦૮/૨૦૨૫

ઉપરોક્ત વિષય અને સંદર્ભિત પત્ર અનવ્યે જણાવવાનું કે ગુજરાત સરકારશ્રીના, રમત-ગમત, યુવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજીત ગુજરાતના તમામ જિલ્લાઓમાં ખેલ મહાકુંભ-૨૦૨૫ નું આયોજન કરવામાં આવેલ છે. આ ખેલ મહાકુંભના કારણે તંદુરસ્ત હરીફાઈ નું વાતાવરણ ઉભુ થાય અને જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ પ્રવેશ માટે પ્રતિભાશાળી ખેલાડીઓની ઓળખ, તથા ચોક્કસ રમતની પ્રતિભાની પસંદગી થાય અને સ્વાસ્થ્ય અંગે જાગૃતિ આવે તેમજ ખેલફૂદનું વાતાવરણ નિર્માણ થાય તેવા ઉદ્દેશથી આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે.

આ ખેલ મહાકુંભમાં બહોળી સંખ્યામાં સ્પર્ધકો ભાગ લે એ હેતુથી પ્રથમ શાળાકક્ષા/ગ્રામ્યકક્ષાએ, ત્યારબાદ તાલુકાકક્ષા/ઝોનકક્ષાએ અને પછી જિલ્લાકક્ષાએ ત્યારબાદ જિલ્લાકક્ષાએ થી રાજ્યકક્ષાએ સ્પર્ધાઓ યોજવામાં આવનાર છે. આ ખેલ મહાકુંભમાં કુલ ૩૯ (ઓગળયાલીસ) રમતોનો ૭ (સાત) વય ગ્રુપમાં સમાવેશ કરી સ્પર્ધાઓ યોજાશે.

ખેલ મહાકુંભ-૨૦૨૫ અંતર્ગત શાળાકક્ષાએ યોજાનાર સ્પર્ધા તા.૨૪/૦૯/૨૦૨૫ થી તા.૨૬/૦૯/૨૦૨૫ દરમિયાન તમામ શાળાઓએ ઉજવણી કરવાની રહેશે. ઉજવણી દરમિયાન ૩૦મી. ૫૦મી. અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પની સ્પર્ધામાં શાળાના ૧૦૦% વિદ્યાર્થીઓ ભાગ લેવડાવાનો રહેશે. તેમજ શાળાકક્ષાએ થી શરૂ થતી કબડ્ડી, ખો-ખો, રસ્સાખેંચ, વોલીબોલ, એથ્લેટીક્સ સ્પર્ધાનું શાળામાં આયોજન કરી ખેલાડીઓ ભાગ લેવડાવાનો રહેશે.

વયજુથ	તારીખ થી જન્મેલા
અંડર - ૯	૦૧/૦૧/૨૦૧૭ અને ત્યારબાદ જન્મેલા
અંડર - ૧૧	૦૧/૦૧/૨૦૧૫ અને ત્યારબાદ જન્મેલા
અંડર - ૧૪	૦૧/૦૧/૨૦૧૨ અને ત્યારબાદ જન્મેલા
અંડર - ૧૭	૦૧/૦૧/૨૦૦૯ અને ત્યારબાદ જન્મેલા
ઓપન વયજુથ	૩૧/૧૨/૨૦૦૮ અને તે પહેલા જન્મેલા
અબવ - ૪૦	૦૧/૦૧/૧૯૬૬ થી ૩૧/૧૨/૧૯૮૫ દરમિયાન જન્મેલા
અબવ - ૬૦	૩૧/૧૨/૧૯૬૫ અને તે પહેલા જન્મેલા

ખાસ નોંધ ૧. સુરત શહેર અને સુરત ગ્રામ્ય સ્પર્ધામાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરેલ સ્લીપ અને જન્મ તારીખ પુરાવો સ્પર્ધા સ્થળે સાથે ફરજિયાત હાજર રાખવાનું રહેશે.

૨. સ્પર્ધામાં ભાગ લેવા માટે વય મર્યાદા નક્કી કરવા માટે કટ ઓફ ડેટ ૩૧/૧૨/૨૦૨૫ રહેશે.

શાળાકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓનો કાર્યક્રમ

ક્રમ	રમતનું નામ	સ્પર્ધાની તારીખ
૧	કબડ્ડી	તા.૨૪/૦૯/૨૦૨૫ થી ૨૬/૦૯/૨૦૨૫
૨	ખો ખો-	
૩	રસ્સાખેંચ	
૪	વોલીબોલ	
૫	એથલેટીક્સ	

નોંધ- ઝોન / તાલુકાકક્ષા સ્પર્ધા અને જિલ્લાકક્ષા સ્પર્ધા ૦૬/૧૧/૨૦૨૫ થી ૩૦/૧૧/૨૦૨૫ દરમિયાન યોજનાર છે. જેનો વિગત વાર પરિપત્ર હવે પછી કરવામાં આવશે

ખાસ સુચના: શાળાકક્ષાએથી શરૂ થતી રમતોમાં ભાગ લેનાર ખેલાડીની વિગત ફરજિયાત જે તે શાળાએ પોતાના યુજર આઇડી દ્વારા વેબસાઇટ પર માહિતી આપવાની રહેશે તેમજ શાળાકક્ષાએ વિજેતા થયેલ ખેલાડીઓની વિગત તથા વિનીંગ મોડ્યુઅલમાં ફરજિયાત દર્શાવવાની રહેશે ઝોનકક્ષા સ્પર્ધામાં તાલુકા/ઝોન ઉપરોક્ત દર્શાવેલ કાર્યવાહી જો કોઈ શાળા દ્વારા કરવામાં નહિ આવે તે શાળાના ખેલાડીઓ ભાગ લઈ શકશે નહિ, જેની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાની રહેશે

નોંધ-તમામ રમતના ખેલાડીઓએ ઉપરોક્ત સમય અને સ્થળ અનુસાર રીપોર્ટિંગ કરવાનું રહેશે. સ્પર્ધા શરૂ થયા બાદ કોઈ ખેલાડીને ભાગ લેવા દેવામાં આવશે નહિ. જેની ખાસ નોંધ લેવી.


તેમજ સ્પર્ધા સ્થળે રમવા આવે ત્યારે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરેલ સ્લીપ સાથે લાવીને કન્વીનર કમ ચીફ રેફરીશ્રીને રજૂ કરવાની રહેશે અન્યથા ભાગ લેવા દેવામાં આવશે નહીં.


- ઉપરોક્ત દર્શાવેલ કાર્યક્રમ ફેરફારને પાત્ર છે ફેરફારની જાણ વ્યાયામ શિક્ષકશ્રીઓનું વ્હોટસઅપ ગ્રુપ દ્વારા કરવામાં આવશે વિશેષ માહિતી માટે કન્વીનરશ્રીનો સંપર્ક કરવો


ખેલ મહાકુંભ-૨૦૨૫ સ્પર્ધાઓના સામાન્ય નિયમો


- ❖ કોઈપણ ખેલાડી એક જ જીલ્લા માંથી કોઈપણ ૨ (બે) રમત ભાગ લઈ શકશે.
- ❖ ખેલ મહાકુંભ અંતર્ગત યોજાતી તમામ સ્પર્ધામાં માત્ર જન્મ તારીખના આધારે કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકશે.
- ❖ ખેલ મહાકુંભ અંતર્ગત યોજાતી તમામ સ્પર્ધાઓ જે તે રમતના ભારતના માન્ય ફેડરેશન/એસોસીએશનના નીતિ નિયમો તેમજ ખેલ મહાકુંભના વખતો વખતના થયેલ સુધારા સાથેના સામાન્ય નિયમો મુજબ યોજવાની રહેશે.
- ❖ અંડર-૯,૧૧,૧૪,૧૭ માં વયજુથમાં આવતા ખેલાડીઓએ પોતાની જ શાળામાંથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- ❖ સ્પર્ધાની તારીખે સ્પર્ધા સ્થળે ખેલાડી/સંસ્થાએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરેલ સ્લીપ તથા ફોટો આઈ.ડી. પૂક તરીકે (આધાર કાર્ડ ફરજિયાત અને શાળા કોલેજોમાં અભ્યાસ કરતા ખેલાડીઓએ બોનાફાઈડ સર્ટીફિકેટ) સાથે લાવવાનું રહેશે.
- શાળાકક્ષાએ થી તાલુકાકક્ષા સ્પર્ધામાં
 - વ્યક્તિગત રમતમાં વિજેતા પ્રથમ, દ્વિતીય, અને તૃતીય સ્થાન મેળવેલ ખેલાડીઓ જ ભાગ લેશે.
 - ટીમ રમતમાં વિજેતા પ્રથમ, દ્વિતીય, તૃતીય સ્થાન મેળવેલ ટીમો જ ભાગ લેશે.
- ઓનલાઇન એન્ટ્રી થયેલ હશે તો જ જે તે ખેલાડી ઉપરની કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ શકશે.


બીડાણ: પરિપત્ર.


જિલ્લા રમત ગમત અધિકારી
સુરત


જિલ્લા રમત વિકાસ અધિકારી
સુરત


શાસનાધિકારી
સુરત


જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી
સુરત


જિલ્લા શિક્ષણાધિકારી
સુરત

➤ **નકલ સવિનય રવાના જાણ સારૂ -**

૧. અગ્રસચિવશ્રી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર.
૨. ડાયરેક્ટર જનરલશ્રી, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર.
૩. માન. મ્યુ.કમિશનરશ્રી, સુરત મહાનગરપાલિકા, સુરત.
૪. કલેક્ટરશ્રી, સુરત જિલ્લા
૫. જિલ્લા વિકાસ અધિકારીશ્રી, સુરત
૬. જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, સુરત શહેર / ગ્રામ્ય (સ્પર્ધા સ્થળે જરૂરી પોલીસ બંદોબસ્ત ફાળવવા બાબત)
૭. સચિવશ્રી, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર.
૮. રજીસ્ટારશ્રી, વીરનર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સુરત. (સુરત શહેરની તમામ કોલેજોમાં જાણ કરવા વિનંતી)
૯. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, સુરત જિલ્લા, સુરત. (તમામ શાળામાં જાણ કરવા વિનંતી)
૧૦. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સુરત જિલ્લા પંચાયત (તમામ શાળામાં જાણ કરવા વિનંતી)
૧૧. સંયુક્ત માહિતી નિયામકશ્રી, સુરત. (તમામ અખબારોમાં વિના મુલ્યે પ્રસિધ્ધ કરવા વિનંતી)
૧૨. તબીબી અધિક્ષકશ્રી, સરકારી હોસ્પિટલ, સુરત (સ્પર્ધા સ્થળે પ્રાથમિક સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા કરવા વિનંતી)
૧૩. પ્રમુખ/મંત્રીશ્રીઓ, વ્યાયામ શિક્ષક મંડળ, સુરત શહેર.
૧૪. પ્રમુખ/મંત્રીશ્રીઓ, રમતગમત મંડળો તમામ, સુરત શહેર.
૧૫. તાલુકા/જિલ્લાકક્ષા, રમત કન્વીનરશ્રીઓ તમામ, સુરત શહેર.

O.I.G.S

BOOK-POST

પ્રતિ,

રવાનગી ક્લાર્ક:

જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર

પેહલો માળ, વેસુ આલવા રોડ,

વેસુ, સુરત. ૩૯૫૦૦૭

Email - dsdo-surat@gujarat.gov.in



ક્રમાંક:એસએજી/ખેમકું ૨૦૨૫/૨૦૨૫-૨૬
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત
વહીવટી બિલ્ડીંગ,
સેક્ટર-૧૩, બી, ખ-૩ સર્કલ નજીક,
વાવોલ રેલ્વે કોસીંગ પાસે,
ગાંધીનગર. તા.૨૬/૦૮/૨૦૨૫

વિષય:- ખેલ મહાકુંભ-૨૦૨૫ રજિસ્ટ્રેશન

પરિપત્ર :-

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. જેમાં શાળા/ગ્રામ્ય, તાલુકા/ઝોનકક્ષા, જિલ્લા/મહાનગરપાલિકાકક્ષા, ઝોનકક્ષા (ટીમ રમત) અને છેલ્લે રાજ્યકક્ષાની સ્પર્ધા માટેનું આયોજન કરવામાં આવેલ છે. ખેલ મહાકુંભ-૨૦૨૫ અંતર્ગત શાળાકક્ષાએ અં-૯, અં-૧૧, અં-૧૪ અને અં-૧૭ની વયજૂથમાં ખેલ મહાકુંભની એથલેટીક્સની રમતમાં તમામ શાળાઓએ ફરજિયાત ભાગ લેવાનો રહેશે.

(૧) રજિસ્ટ્રેશન:-

- ખેલ મહાકુંભ-૨૦૨૫નું ઓનલાઇન રજિસ્ટ્રેશન તા.૨૯/૦૮/૨૦૨૫થી શરૂ કરવામાં આવનાર છે. ખેલ મહાકુંભ-૨૦૨૫ના રજિસ્ટ્રેશનની છેલ્લી તા.૨૨/૦૯/૨૦૨૫ સાંજે ૬.૦૦ સુધીની રહેશે.
- ખેલ મહાકુંભ-૨૦૨૫માં ભાગ લેવા માટે નિયત વયજૂથના તમામ ખેલાડીઓ દ્વારા ફરજિયાત વેબસાઇટ <https://khelmahakumbh.gujarat.gov.in> પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
- પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં જ ભાગ લઈ શકશે. કોઇપણ ખેલાડી બે રમત કરતાં વધુ રમતમાં ભાગ લઈ શકશે નહીં. એક જ KMK IDથી ખેલાડીએ બે રમતમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તો જ ખેલાડીનું બે રમતમાં રજિસ્ટ્રેશન માન્ય ગણવામાં આવશે. એક જ KMK IDથી બે રમતમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હશે અને વિજેતા થશે તો જ રોકડ-પુરસ્કાર મળવાપાત્ર રહેશે.
- જે ખેલાડી પાસે જુના KMK ID હોય તેઓએ જુના KMK IDથી ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
- અં-૯, અં-૧૧, અં-૧૪ અને અં-૧૭ ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતાં ખેલાડીઓએ જે તે શાળામાંથી રજિસ્ટ્રેશન કરવાનું ફરજિયાત રહેશે.
- કોલેજમાં અભ્યાસ કરતાં ખેલાડીઓએ ઓનલાઇન અથવા કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરી શકશે.
- અભ્યાસ ન કરતાં હોય તેવા ખેલાડીઓ જિલ્લાની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી પોતાના વયજૂથમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે.

(૨) સ્પર્ધાઓ

૧. શાળા અને ગ્રામ્યકક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ

ક્રમ	વયજૂથ	રમત
૧	૯ વર્ષથી નીચે	૩૦ મી. દોડ અને સ્ટેન્ડીંગ બ્રોડજમ્પ
૨	૧૧ વર્ષથી નીચે	૫૦ મી. દોડ અને સ્ટેન્ડીંગ બ્રોડજમ્પ
૩	૧૪ વર્ષથી નીચે	એથલેટીક્સ, વોલીબોલ, ખોખો, કબડ્ડી
૪	૧૭ વર્ષથી નીચે	એથલેટીક્સ, રસ્સાખેંચ, વોલીબોલ, ખોખો, કબડ્ડી
૫	ઓપન એજ ગ્રુપ	એથલેટીક્સ, રસ્સાખેંચ, વોલીબોલ, ખોખો, કબડ્ડી
૬	૪૦ વર્ષથી ઉપર	રસ્સાખેંચ
૭	૬૦ વર્ષથી ઉપર	રસ્સાખેંચ

૨. તાલુકાકક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ

ક્રમ	વયજુથ	રમત
૧	૧૧ વર્ષથી નીચે	ચેસ
૨	૧૪ વર્ષથી નીચે	એથલેટીક્સ, ચેસ, યોગાસન
૩	૧૭ વર્ષથી નીચે	એથલેટીક્સ, ચેસ, યોગાસન
૪	ઓપન એજ ગ્રુપ	એથલેટીક્સ, ચેસ, યોગાસન
૫	૪૦ વર્ષથી ઉપર	ચેસ
૬	૬૦ વર્ષથી ઉપર	ચેસ

૩. જિલ્લાકક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ

ક્રમ	વયજુથ	રમત
૧	૧૧ વર્ષથી નીચે	એથલેટીક્સ, સ્વીમીંગ, સ્કેટીંગ, ટેબલ ટેનીસ, લોન ટેનીસ, બેડમિન્ટન
૨	૧૪ વર્ષથી નીચે	સ્વીમીંગ, સ્કેટીંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ, ટેબલટેનીસ, લોનટેનીસ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, ટેકવોન્ડો, યોગાસન, કરાટે, આર્ટીસ્ટીક સ્કેટીંગ
૩	૧૭ વર્ષથી નીચે	સ્વીમીંગ, સ્કેટીંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ, ટેબલ ટેનીસ, લોન ટેનીસ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, ટેકવોન્ડો, યોગાસન, કરાટે, રઝ્બી
૪	ઓપન એજ ગ્રુપ	સ્વીમીંગ, સ્કેટીંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ, ટેબલ ટેનીસ, લોન ટેનીસ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, ટેકવોન્ડો, શુટીંગબોલ, કરાટે, યોગાસન, રઝ્બી, આર્ટીસ્ટીક સ્કેટીંગ
૫	૪૦ વર્ષથી ઉપર	બેડમિન્ટન, ટેબલ ટેનીસ, લોન ટેનીસ, સ્વીમીંગ, શુટીંગબોલ
૬	૬૦ વર્ષથી ઉપર	બેડમિન્ટન, ટેબલ ટેનીસ, લોન ટેનીસ, સ્વીમીંગ


૪. સીધી રાજ્યકક્ષાએ યોજાતી સ્પર્ધાઓ

ક્રમ	વયજુથ	રમત
૧	૧૧ વર્ષથી નીચે	સ્વીમીંગ, સ્કેટીંગ
૨	૧૪ વર્ષથી નીચે	એથલેટીક્સ, સ્વીમીંગ, જુડો, કુસ્તી, આર્ચરી, ફેન્સીંગ, બોક્સીંગ, શુટીંગ, ટેકવોન્ડો, જિમ્નાસ્ટીક્સ, સ્કેટીંગ, મલખમ્બ, સ્પોર્ટ્સ ક્લાઈમીંગ, રોલબોલ, સેપક ટકરાવ
૩	૧૭ વર્ષથી નીચે	એથલેટીક્સ, સ્વીમીંગ, જુડો, કુસ્તી, આર્ચરી, ટેકવોન્ડો, વેઈટલીફ્ટીંગ, ફેન્સીંગ, બોક્સીંગ, શુટીંગ, જિમ્નાસ્ટીક્સ, સ્કેટીંગ, મલખમ્બ, સોફ્ટ ટેનીસ, સ્પોર્ટ્સ ક્લાઈમીંગ, રોલબોલ, સેપક ટકરાવ, વુડબોલ
૪	ઓપન એજ ગ્રુપ	એથલેટીક્સ, સ્વીમીંગ, ટેકવોન્ડો, જુડો, કુસ્તી, આર્ચરી, જિમ્નાસ્ટીક્સ, સાયકલિંગ (૨૦ કિ.મી.), શુટીંગ, સ્કેટીંગ, વેઈટલીફ્ટીંગ, ફેન્સીંગ, બોક્સીંગ, મલખમ્બ, સોફ્ટ ટેનીસ, સ્પોર્ટ્સ ક્લાઈમીંગ, ઘોડેસવારી, વુડબોલ, બીચ હેન્ડબોલ, બીચ વોલીબોલ
૫	૪૦ અને ૬૦ વર્ષથી ઉપર	યોગાસન

(3) સ્પર્ધાના સામાન્ય નિયમો :-

- સ્પર્ધામાં ભાગ લેવા માટે વય મર્યાદા નક્કી કરવા માટે કટ ઓફ ડેટ ૩૧/૧૨/૨૦૨૫ રહેશે.
- જે કક્ષાએથી સ્પર્ધા શરૂ થાય ત્યાં ટીમ રમતમાં માત્ર એક જ શાળાના વિદ્યાર્થીઓની ટીમ હોવી જોઈએ. જેના આચાર્ય અને શાળાનો કોડ નંબર એક હોવો જોઈએ અને બોનાફાઈડ વિદ્યાર્થીઓ હોવા જોઈએ.
- રજિસ્ટ્રેશન કરતી વખતે જે તે ખેલાડીએ જન્મ તારીખ સાચી દર્શાવવાની રહેશે. જન્મ તારીખ ખોટી દર્શાવી રજિસ્ટ્રેશન થયેલ હશે તો તે ખેલાડી ખેલ મહાકુંભની સ્પર્ધામાં ૩ વર્ષ સુધી ભાગ લઈ શકશે નહીં.
- કોઈ પણ રમતવીર કોઈ પણ એક જિલ્લામાંથી બે જ રમતમાં ભાગ લઈ શકશે.
- રજિસ્ટ્રેશનની કોઈ પણ સમસ્યા બાબતે રાજ્ય સ્તરે ટોલ ફ્રી નંબર. ૧૮૦૦ ૨૭૪૬ ૧૫૧ ઉપર સંપર્ક કરવાથી માર્ગદર્શન પુરું પાડવામાં આવશે.
- ખેલાડી ગુજરાત રાજ્યનો જન્મથી વતની હોવો જોઈએ અથવા ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષથી અભ્યાસ/ નોકરી/વ્યવસાય/ નિવાસ કરતા હોવો જોઈએ. જેના આધાર પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે.
- જે ખેલાડી જે જિલ્લામાં ભાગ લે તે જિલ્લામાં નિવાસ/વ્યવસાય છેલ્લા ૬ માસથી કરતો હોવો જોઈએ તેમજ તેના આધાર-પુરાવા કે પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે.
- શાળામાં/કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ જ્યાં અભ્યાસ કરતાં હોય તે તાલુકા/જિલ્લામાંથી ભાગ લઈ શકશે.
- કર્મચારીના કિસ્સામાં અન્ય રાજ્યમાંથી બદલી/ડેપ્યુટેશનથી આવેલ કર્મચારીએ રજિસ્ટ્રેશનની તારીખે ઓછામાં ઓછા છ માસ પહેલાં બદલી થઈને ગુજરાતમાં જે તે જિલ્લામાં આવેલ હોય તો જ ભાગ લઈ શકશે.
- સ્પર્ધા સમયે ખેલાડીએ આધારકાર્ડ, ચુંટણી કાર્ડ, બોનાફાઈડ અને બેંકની પાસબુકની નકલ સાથે લઈને આવવાની રહેશે.

ખેલ મહાકુંભ એ સરકારશ્રીનાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગનો ફોલોઅપ કાર્યક્રમ હોઈ તેને સફળ બનાવવા અસરકારક આયોજન અને અમલીકરણ કરવા આ પરિપત્રની સૂચનાનું ચુસ્તપણે પાલન કરવા આથી જણાવવામાં આવે છે.


સંદીપ સાગોડે (આઈ.એ.એસ)

ડાયરેક્ટર જનરલ
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત
ગાંધીનગર

બિડાણ:-પત્રક- અ - રોકડ- પુરસ્કાર

નકલ સવિનય રવાના જાણ સારું

(૧) અંગત સચિવશ્રી,

માન.મંત્રીશ્રી, રમતગમત, યુવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગુજરાત સરકાર, ગાંધીનગર

(૨) અંગત સચિવશ્રી,

માન. અગ્ર સચિવશ્રી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર

પ્રતિ,

(૧) કલેક્ટરશ્રી, તમામ

(૨) મ્યુ.કમિશનરશ્રી, તમામ

(૩) જિલ્લા વિકાસ અધિકારીશ્રી, તમામ

(૪) વાઈસ ચાન્સેલરશ્રી, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ગાંધીનગર

(૫) કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર

(૬) કમિશનરશ્રી, ઉચ્ચ શિક્ષણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર

(૭) પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર

(૮) નિયામકશ્રી, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલિમ પરિષદ, ગાંધીનગર

(૯) જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, તમામ

(૧૦) જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ

(૧૧) પ્રિન્સીપાલશ્રી, જીલ્લા શિક્ષણ અને તાલિમ ભવન તમામ

(૧૨) શાસનાધિકારીશ્રી, મ્યુનિ.કોર્પોરેશન તમામ

(૧૩) પ્રમુખ/મંત્રીશ્રી, રાજ્યકક્ષાના માન્ય રમતગમત મંડળો

(૧૪) જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, તમામ

(૧૫) જિલ્લા રમત ગમત અધિકારીશ્રી, તમામ

(૧૬) શાખા અધિકારીશ્રી, એસ.એ.જી., તમામ

પત્રક-અ

ખેલ મહાકુંભ-૨૦૨૫					
તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાના વિજેતા ખેલાડીઓને ચૂકવવાપાત્ર રોકડપુરસ્કાર					
ક્રમ	વિગત	કક્ષા	વિજેતા ક્રમ	વ્યક્તિગત રૂ.	ટીમ રૂ.
અં-૯, અં-૧૧, અં-૧૪, અં-૧૭, ઓપન એઈજ ગ્રુપ, ૪૦ વર્ષથી ઉપર અને ૬૦ વર્ષથી ઉપર					
૧	ખેલાડીઓ	તાલુકાકક્ષા	પ્રથમ	૧૫૦૦	૧૦૦૦
			દ્વિતીય	૧૦૦૦	૭૫૦
			તૃતીય	૭૫૦	૫૦૦
		જિલ્લાકક્ષા	પ્રથમ	૫૦૦૦	૩૦૦૦
			દ્વિતીય	૩૦૦૦	૨૦૦૦
			તૃતીય	૨૦૦૦	૧૦૦૦
		રાજ્યકક્ષા	પ્રથમ	૧૦૦૦૦	૫૦૦૦
			દ્વિતીય	૭૦૦૦	૩૦૦૦
			તૃતીય	૫૦૦૦	૨૦૦૦
શ્રેષ્ઠ શાળા					
૨	શાળા	તાલુકાકક્ષા	પ્રથમ	૨૫૦૦૦	-
			દ્વિતીય	૧૫૦૦૦	-
			તૃતીય	૧૦૦૦૦	-
૩	શાળા	જિલ્લાકક્ષા	પ્રથમ	૧૫૦૦૦૦	-
			દ્વિતીય	૧૦૦૦૦૦	-
			તૃતીય	૭૫૦૦૦	-
૪	શાળા	રાજ્યકક્ષા	પ્રથમ	૫૦૦૦૦૦	-
			દ્વિતીય	૩૦૦૦૦૦	-
			તૃતીય	૨૦૦૦૦૦	-

રાજ્યકક્ષાના વિજેતા ખેલાડીઓના કોચને ચૂકવવાપાત્ર રોકડપુરસ્કાર					
ક્રમ	વિગત	કક્ષા	વિજેતા ક્રમ	વ્યક્તિગત રૂ.	ટીમ રૂ.
અં-૯, અં-૧૧, અં-૧૪, અં-૧૭, ઓપન એઈજ ગ્રુપ					
૧	કોચ	રાજ્યકક્ષા	પ્રથમ	૧૫૦૦	૧૦૦૦
			દ્વિતીય	૧૨૦૦	૭૫૦
			તૃતીય	૯૦૦	૫૦૦

અંક ૯ (તા.૦૧/૦૧/૨૦૧૭ અને તે પછી જન્મેલા)	
(જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે <input checked="" type="checkbox"/> કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે.)	
સીધી શાળા કક્ષાથી શરૂ થતી સ્પર્ધા	
એથલેટીક્સ	<input type="checkbox"/> ૩૦ મીટર <input type="checkbox"/> સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ
અંક ૧૧ (તા.૦૧/૦૧/૨૦૧૫ અને તે પછી જન્મેલા)	
(જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે <input checked="" type="checkbox"/> કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે.)	
સીધી શાળા કક્ષાથી શરૂ થતી સ્પર્ધા	
એથલેટીક્સ	<input type="checkbox"/> ૫૦ મીટર <input type="checkbox"/> સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ
સીધી તાલુકા / ઝોન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા	
ચેસ	<input type="checkbox"/> ચેસ
સીધી જિલ્લા/કોર્પોરેશન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા	
એથલેટીક્સ	<input type="checkbox"/> ૧૦૦ મીટર <input type="checkbox"/> લાંબી કુદ
સ્કેટીંગ	કવોડ <input type="checkbox"/> રીંક ૧ (૫૦૦ મી.) <input type="checkbox"/> રીંક ૨ (૧૦૦૦ મી.)
	ઈનલાઈન <input type="checkbox"/> રીંક ૩ (૫૦૦ મી.) <input type="checkbox"/> રીંક ૪ (૧૦૦૦ મી.)
સ્વીમીંગ	<input type="checkbox"/> ૧૦૦ મીટર ફ્રી સ્ટાઇલ
બેડમીન્ટન	<input type="checkbox"/> સીંગલ્સ
ટેબલ ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ
લોન ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ
સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા	
સ્વીમીંગ	વ્યક્તિગત મીડલે (૨૦૦ મીટર)
સ્કેટીંગ	કવોડ <input type="checkbox"/> રોડ ૧ (૧૫૦૦ મી.)
	ઈનલાઈન <input type="checkbox"/> રોડ ૨ (૫૦૦મી) <input type="checkbox"/> રોડ રેસ ૩ (૧૫૦૦મી)
અંક ૧૪ (તા.૦૧/૦૧/૨૦૧૨ અને તે પછી જન્મેલા)	
સીધી શાળા કક્ષાથી શરૂ થતી સ્પર્ધા	
એથલેટીક્સ	<input type="checkbox"/> ૧૦૦મીટર <input type="checkbox"/> લાંબીકુદ <input type="checkbox"/> ગોળા ફેંક
વોલીબોલ	<input type="checkbox"/> વોલીબોલ
ખો-ખો	<input type="checkbox"/> ખો-ખો
કબડ્ડી	<input type="checkbox"/> ભાઈઓ (૫૧ કિગ્રા) <input type="checkbox"/> બહેનો (૪૮ કિગ્રા)
સીધી તાલુકા / ઝોન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા	
એથલેટીક્સ	<input type="checkbox"/> ૨૦૦ મીટર <input type="checkbox"/> ૪૦૦ મીટર <input type="checkbox"/> ૬૦૦ મીટર <input type="checkbox"/> ઉચીકુદ <input type="checkbox"/> ચક્રફેંક
ચેસ	<input type="checkbox"/> ચેસ
યોગાસન	<input type="checkbox"/> વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ (ગ્રુપ A, B, C અને મનપસંદગીના આસનો)
સીધી જિલ્લા/કોર્પોરેશન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા	
યોગાસન	<input type="checkbox"/> આર્ટિસ્ટિક યોગા(ટ્રેડિશનલ) <input type="checkbox"/> રિધમીક યોગા
આર્ચરી	<input type="checkbox"/> ઇન્ડિયન રાઉન્ડ (વ્યક્તિગત ઓવરબોલ)
સ્વીમીંગ	<input type="checkbox"/> ૧૦૦ મી.ફ્રી સ્ટાઇલ <input type="checkbox"/> બેક સ્ટ્રોક ૧૦૦ મી <input type="checkbox"/> બટર ફલાય સ્ટ્રોક ૧૦૦ મી. <input type="checkbox"/> ૪૦૦ મી.ફ્રી સ્ટાઇલ <input type="checkbox"/> બ્રેસ્ટ સ્ટ્રોક ૧૦૦ મી <input type="checkbox"/> વ્યક્તિગત મીડલે ૨૦૦ મી.
આઈસ્ટીક સ્કેટીંગ	<input type="checkbox"/> ફ્રી સ્કેટીંગ <input type="checkbox"/> સોલોડાન્સ <input type="checkbox"/> ફીગર <input type="checkbox"/> ક્વોટ્ટ
સ્કેટીંગ	કવોડ <input type="checkbox"/> રીંક ૧ (૫૦૦ મી.) <input type="checkbox"/> રીંક ૨ (૧૦૦૦ મી.)
	ઈનલાઈન <input type="checkbox"/> રીંક ૩ (૫૦૦ મી.) <input type="checkbox"/> રીંક ૪ (૧૦૦૦ મી.)
જુડો	ભાઈઓ <input type="checkbox"/> ૨૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૨૫ કિગ્રાથી ઉપર અને -૩૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૩૦ કિગ્રાથી ઉપર અને -૩૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૩૫ કિગ્રાથી ઉપર અને -૪૦ કિગ્રા સુધી
	બહેનો <input type="checkbox"/> ૨૩ કિગ્રા સુધી <input type="checkbox"/> ૨૩ કિગ્રાથી ઉપર અને -૨૭ કિગ્રા સુધી <input type="checkbox"/> ૨૭ કિગ્રાથી ઉપર અને -૩૨ કિગ્રા સુધી <input type="checkbox"/> ૩૨ કિગ્રાથી ઉપર અને -૩૬ કિગ્રા સુધી
કુસ્તી	ભાઈઓ <input type="checkbox"/> ૩૦-૩૫ કિગ્રા <input type="checkbox"/> ૩૫-૩૮ કિગ્રા <input type="checkbox"/> ૩૮-૪૧ કિગ્રા <input type="checkbox"/> ૪૧-૪૪ કિગ્રા <input type="checkbox"/> ૪૪-૪૮ કિગ્રા
	બહેનો <input type="checkbox"/> ૨૬-૩૦ કિગ્રા <input type="checkbox"/> ૩૦-૩૩ કિગ્રા <input type="checkbox"/> ૩૩-૩૬ કિગ્રા <input type="checkbox"/> ૩૬-૩૯ કિગ્રા <input type="checkbox"/> ૩૯-૪૨ કિગ્રા
ટેકવેન્ડો	ભાઈઓ <input type="checkbox"/> ૧૮ કિગ્રા સુધી <input type="checkbox"/> ૧૮-૨૧ કિગ્રા <input type="checkbox"/> ૨૩-૨૫ કિગ્રા <input type="checkbox"/> ૨૭-૨૯ કિગ્રા <input type="checkbox"/> ૪૧ કિગ્રાથી ઉપર
	બહેનો <input type="checkbox"/> ૧૬ કિગ્રા સુધી <input type="checkbox"/> ૧૮-૨૦ કિગ્રા <input type="checkbox"/> ૨૨-૨૪ કિગ્રા <input type="checkbox"/> ૨૬-૨૯ કિગ્રા <input type="checkbox"/> ૩૮ કિગ્રાથી ઉપર
બેડમીન્ટન	<input type="checkbox"/> સીંગલ્સ
બાસ્કેટબોલ	<input type="checkbox"/> બાસ્કેટબોલ
ટેબલ ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ
લોન ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ
હેન્ડબોલ	<input type="checkbox"/> હેન્ડબોલ
હોકી	<input type="checkbox"/> હોકી
ફુટબોલ	<input type="checkbox"/> ફુટબોલ
કરાટે	ભાઈઓ <input type="checkbox"/> ૨૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૨૦-૨૫ કિગ્રા <input type="checkbox"/> ૨૫-૩૦ કિગ્રા <input type="checkbox"/> ૩૦-૩૫ કિગ્રા <input type="checkbox"/> ૩૫-૪૦ કિગ્રા <input type="checkbox"/> ૪૦-૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૫-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૫ કિગ્રા <input type="checkbox"/> ૫૫-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦ કિગ્રાથી ઉપર
	બહેનો <input type="checkbox"/> ૧૮ કિગ્રા સુધી <input type="checkbox"/> ૧૮-૨૨ કિગ્રા <input type="checkbox"/> ૨૨-૨૪ કિગ્રા <input type="checkbox"/> ૨૪-૨૬ કિગ્રા <input type="checkbox"/> ૨૬-૩૦ કિગ્રા <input type="checkbox"/> ૩૦-૩૪ કિગ્રા <input type="checkbox"/> ૩૪-૩૮ કિગ્રા <input type="checkbox"/> ૩૮-૪૨ કિગ્રા <input type="checkbox"/> ૪૨-૪૬ કિગ્રા <input type="checkbox"/> ૪૬-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦ કિગ્રાથી ઉપર

નોંધ:- યોગાસન માટે,
 > ગ્રુપ-A-પશ્ચિમોત્તાસન, સર્વોગાસન, મત્સ્યાસન, અર્ધમત્સ્યાસન, પુર્ણ ધનુરાસન, ઉત્તાન પાદાસન
 > ગ્રુપ-B પુર્ણ ચક્રાસન, કુકુટાસન, ભુમાસનપુર્ણ, સલભાસન, બકાસન, શિર્ષાસન
 > ગ્રુપ-C સાંખ્યાસન, વ્યાધાસન, ઉર્ધ્વ કુકુટાસન, ઉત્તિશતિતિવાસન, પદ્મ મથુરાસન, ઉત્તિશ્યાપાદસ્તાસન
 > રાજ્યકક્ષાએ બેસ્ટ એક ધ બેસ્ટ રમાશે.

નોંધ:- શાળાકક્ષાથી રાજ્યકક્ષા સુધીની સ્પર્ધા માટે
 > યોગાસનમાં ખેલાડી દ્વારા વધુમાં વધુ ૨ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
 > બે ઇવેન્ટમાં ભાગ લેવા માટે વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ ઇવેન્ટની પસંદગી કરવાની ફરજિયાત રહેશે.
 > એથલેટીક્સ રમતમાં વધુ માં વધુ ૨ ઇવેન્ટ અને ૧ રીલે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
 > સ્વીમીંગ રમતમાં વધુમાં વધુ ૩ ઇવેન્ટ અને ૨ રીલેમાં ભાગ લઈ શકશે.
 > જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ સ્કેટીંગમાં કવોડ અથવા ઇનલાઈન બેમાંથી એક ઇવેન્ટમાં ભાગ લઈ શકશે
 > કુસ્તી, ટેકવેન્ડો, બોક્સીંગ, કારાટે અને જુડોની રમતમાં કોઇ પણ એક વજન ગ્રુપમાં ભાગ લઈ શકશે.

❖ સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❖	
એથલેટિક્સ	<input type="checkbox"/> ૮૦ મી હર્ડલ્સ <input type="checkbox"/> ૪ x ૧૦૦ મી રીલે
સ્વીમીંગ	<input type="checkbox"/> ફ્રી સ્ટાઇલ ૫૦મી <input type="checkbox"/> ફ્રી સ્ટાઇલ ૨૦૦મી <input type="checkbox"/> ફ્રી સ્ટાઇલ રીલે ૪x૧૦૦મી <input type="checkbox"/> બેક સ્ટ્રોક ૫૦ મી <input type="checkbox"/> બેક સ્ટ્રોક ૨૦૦ મી <input type="checkbox"/> મીડલ રીલે ૪x૧૦૦મી
	<input type="checkbox"/> બ્રેસ્ટ સ્ટ્રોક ૫૦ મી <input type="checkbox"/> બ્રેસ્ટ સ્ટ્રોક ૨૦૦મી <input type="checkbox"/> બટર ફ્લાય સ્ટ્રોક ૫૦ મી <input type="checkbox"/> બટરફ્લાય સ્ટ્રોક ૨૦૦મી
જુડો	ભાઈઓ <input type="checkbox"/> ૪૦ કિગ્રાથી ઉપર અને -૪૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૫ કિગ્રાથી ઉપર અને -૫૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૫૦ કિગ્રાથી ઉપર
	બહેનો <input type="checkbox"/> ૩૬ કિગ્રાથી ઉપર અને -૪૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૦ કિગ્રાથી ઉપર અને -૪૪ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૪ કિગ્રાથી ઉપર
કુસ્તી	ભાઈઓ <input type="checkbox"/> ૪૮-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૨-૫૭ કિગ્રા <input type="checkbox"/> ૫૭-૬૨ કિગ્રા <input type="checkbox"/> ૬૨-૬૮ કિગ્રા <input type="checkbox"/> ૬૮-૭૫ કિગ્રા
	બહેનો <input type="checkbox"/> ૪૨-૪૬ કિગ્રા <input type="checkbox"/> ૪૬-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૫૮ કિગ્રા <input type="checkbox"/> ૫૮-૬૨ કિગ્રા
ટેકવેન્ડો	ભાઈઓ <input type="checkbox"/> ૨૧-૨૩ કિગ્રા <input type="checkbox"/> ૨૫-૨૭ કિગ્રા <input type="checkbox"/> ૨૯-૩૨ કિગ્રા <input type="checkbox"/> ૩૨-૩૫ કિગ્રા <input type="checkbox"/> ૩૫-૩૮ કિગ્રા <input type="checkbox"/> ૩૮-૪૧ કિગ્રા
	બહેનો <input type="checkbox"/> ૧૬-૧૮ કિગ્રા <input type="checkbox"/> ૨૦-૨૨ કિગ્રા <input type="checkbox"/> ૨૪-૨૬ કિગ્રા <input type="checkbox"/> ૨૯-૩૨ કિગ્રા <input type="checkbox"/> ૩૨-૩૫ કિગ્રા <input type="checkbox"/> ૩૫-૩૮ કિગ્રા
જીમ્નાસ્ટીક	ભાઈઓ <input type="checkbox"/> ફ્લોર એક્સાઈઝ <input type="checkbox"/> વોલ્ટીંગ ટેબલ <input type="checkbox"/> રોમનરિંગ <input type="checkbox"/> પેરલલબાર <input type="checkbox"/> પોમેલહોર્સ <input type="checkbox"/> હોરિઝન્ટલબાર
	બહેનો <input type="checkbox"/> ફ્લોર એક્સાઈઝ <input type="checkbox"/> વોલ્ટીંગ ટેબલ <input type="checkbox"/> બેલેસીંગબીમ <input type="checkbox"/> અનઈવનબાર <input type="checkbox"/> હૂપ(રિધમીક) <input type="checkbox"/> ક્લબ(રિધમીક) <input type="checkbox"/> બોલ(રિધમીક) <input type="checkbox"/> રીબન (રિધમીક)
સ્કેટીંગ	કવોડ <input type="checkbox"/> રોડ ૧ (૨૦૦૦ મી.)
	ઈનલાઈન <input type="checkbox"/> રોડ ૨ (૫૦૦ મી.) <input type="checkbox"/> રોડ રેસ ૩ (૨૦૦૦ મી.)
આર્ચરી	રીફલ રાઉન્ડ <input type="checkbox"/> વ્યક્તિગત ઓવરશોલ <input type="checkbox"/> વ્યક્તિગત એલિમીનેશન રાઉન્ડ <input type="checkbox"/> ટીમ <input type="checkbox"/> મીક્સ ટીમ
	કમ્પાઉન્ડ રાઉન્ડ <input type="checkbox"/> વ્યક્તિગત ઓવરશોલ <input type="checkbox"/> વ્યક્તિગત એલિમીનેશન રાઉન્ડ <input type="checkbox"/> ટીમ <input type="checkbox"/> મીક્સ ટીમ
શુટીંગ	<input type="checkbox"/> ૧૦ મી.એર પીસ્તોલ <input type="checkbox"/> ૧૦ મી. એર રાયફલ પીપ <input type="checkbox"/> ૧૦ મી. ઓપન સાઇટ એર રાયફલ
ટેન્સીંગ	<input type="checkbox"/> ક્લોથ <input type="checkbox"/> ઈપી <input type="checkbox"/> સેબર
બોક્સીંગ	ભાઈઓ <input type="checkbox"/> ૨૮-૩૦ કિગ્રા <input type="checkbox"/> ૩૦-૩૨ કિગ્રા <input type="checkbox"/> ૩૨-૩૪ કિગ્રા <input type="checkbox"/> ૩૪-૩૬ કિગ્રા <input type="checkbox"/> ૩૬-૩૮ કિગ્રા <input type="checkbox"/> ૩૮-૪૦ કિગ્રા <input type="checkbox"/> ૪૦-૪૨ કિગ્રા <input type="checkbox"/> ૪૨-૪૪ કિગ્રા <input type="checkbox"/> ૪૪-૪૬ કિગ્રા <input type="checkbox"/> ૪૬-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૦ કિગ્રા
મલખંલ	<input type="checkbox"/> રોપ મલખંલ (ફક્ત બહેનો માટે) <input type="checkbox"/> પોલ મલખંલ (ફક્ત ભાઈઓ માટે)
રોલબોલ	<input type="checkbox"/> રોલબોલ
સેપક ટકરાવ	<input type="checkbox"/> રેગુ <input type="checkbox"/> કવોડસ
સ્પોર્ટ્સ ક્લામીંગ	<input type="checkbox"/> લીડ ક્લામીંગ <input type="checkbox"/> સ્પીડ ક્લામીંગ <input type="checkbox"/> બોલ્ડરીંગ

> જીમ્નાસ્ટીક સ્પર્ધામાં ખેલાડી કોઈ પણ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે

> જીમ્નાસ્ટીક સ્પર્ધામાં નિયમ પ્રમાણે ભાઈઓએ ૬ (છ) પેટા રમત અને બહેનોએ ૪ (ચાર) પેટા રમતમાં ભાગ લેવાનો રહેશે.

> શુટીંગ સ્પર્ધામાં સ્પર્ધકોએ શુટીંગ માટે પોતાની રાઈફલ લાવવાની રહેશે. ત્રણમાંથી કોઈ પણ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.

> શુટીંગ સ્પર્ધામાં એર પીસ્તોલની એક અથવા એર રાયફલ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે

ખેલ મહાકુંભ-૨૦૨૨

અંક ૨ ૧૭ (તા.૦૧/૦૧/૨૦૦૯ અને તે પછી જન્મેલા)	
જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે <input checked="" type="checkbox"/> કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે.)	
❖ સીધી શાળા કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❖	
એથલેટિક્સ	<input type="checkbox"/> ૧૦૦ મી. <input type="checkbox"/> લાંબીકૂદ <input type="checkbox"/> લંગડીફાઇ કૂદ <input type="checkbox"/> ગોળાકેંક
રસ્સાખેંચ	<input type="checkbox"/> ભાઈઓ ૪૮૦ કિગ્રા <input type="checkbox"/> બહેનો ૪૦૦ કિગ્રા નોંધ: (૮ ખેલાડીઓનું કુલ વજન)
વોલીબોલ	<input type="checkbox"/> વોલીબોલ
ખો-ખો	<input type="checkbox"/> ખો-ખો
કબડ્ડી	<input type="checkbox"/> ભાઈઓ (૫૫ કિગ્રા) <input type="checkbox"/> બહેનો (૫૫ કિગ્રા)
❖ સીધી તાલુકા/ઝોનકક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❖	
એથલેટિક્સ	<input type="checkbox"/> ૨૦૦મી <input type="checkbox"/> ૪૦૦મી <input type="checkbox"/> ૮૦૦ મી <input type="checkbox"/> ૧૫૦૦ મી. <input type="checkbox"/> ઉચીકૂદ <input type="checkbox"/> બરછીકેંક <input type="checkbox"/> ચક્રકેંક
થેસ	<input type="checkbox"/> થેસ
યોગાસન	<input type="checkbox"/> વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ (ગ્રુપ A, B, C અને મનપસંદગીના આસનો)
❖ સીધી જિલ્લા/કોર્પોરેશન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❖	
આર્ચરી	<input type="checkbox"/> ઇન્ડિયન રાઉન્ડ (વ્યક્તિગત ઓવરશોલ)
યોગાસન	<input type="checkbox"/> આર્થિસ્ટિક યોગા(ટ્રેડિશનલ) <input type="checkbox"/> રિધમીક યોગા
સ્વીમીંગ	<input type="checkbox"/> ૧૦૦ મી.ફ્રી સ્ટાઇલ <input type="checkbox"/> બેક સ્ટ્રોક ૧૦૦ મી <input type="checkbox"/> બટર ફ્લાય સ્ટ્રોક ૧૦૦ મી.
	<input type="checkbox"/> ૪૦૦ મી.ફ્રી સ્ટાઇલ <input type="checkbox"/> બ્રેસ્ટ સ્ટ્રોક ૧૦૦ મી <input type="checkbox"/> વ્યક્તિગત મીડલ ૨૦૦ મી.
સ્કેટીંગ	કવોડ <input type="checkbox"/> રીક ૧ (૫૦૦ મી.) <input type="checkbox"/> રીક ૨(૧૦૦૦ મી.)
	ઈનલાઈન <input type="checkbox"/> રીક ૩(૫૦૦ મી.) <input type="checkbox"/> રીક ૪(૧૦૦૦ મી.)
જુડો	ભાઈઓ <input type="checkbox"/> ૪૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૦ કિગ્રાથી ઉપર અને -૪૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૫ કિગ્રાથી ઉપર અને -૫૦ કિગ્રા સુધી
	બહેનો <input type="checkbox"/> ૩૬ કિગ્રા સુધી <input type="checkbox"/> ૩૬ કિગ્રાથી ઉપર અને -૪૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૦ કિગ્રાથી ઉપર અને -૪૪ કિગ્રા સુધી
કુસ્તી	ભાઈઓ-ફ્રીસ્ટાઇલ <input type="checkbox"/> ૪૧-૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૫-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૧ કિગ્રા <input type="checkbox"/> ૫૧-૫૫ કિગ્રા <input type="checkbox"/> ૫૫-૬૦ કિગ્રા
	બહેનો-ફ્રીસ્ટાઇલ <input type="checkbox"/> ૩૬-૪૦ કિગ્રા <input type="checkbox"/> ૪૦-૪૩ કિગ્રા <input type="checkbox"/> ૪૩-૪૬ કિગ્રા <input type="checkbox"/> ૪૬-૪૯ કિગ્રા <input type="checkbox"/> ૪૯-૫૩ કિગ્રા
ટેકવેન્ડો	ભાઈઓ <input type="checkbox"/> ૩૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૩૫ -૩૮ કિગ્રા <input type="checkbox"/> ૪૧-૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૧ કિગ્રા <input type="checkbox"/> ૫૫-૫૮ કિગ્રા <input type="checkbox"/> ૭૮ કિગ્રા થી ઉપર
	બહેનો <input type="checkbox"/> ૩૨ કિગ્રા સુધી <input type="checkbox"/> ૩૮-૪૨ કિગ્રા <input type="checkbox"/> ૪૪-૪૬ કિગ્રા <input type="checkbox"/> ૫૨-૫૫ કિગ્રા <input type="checkbox"/> ૬૮ કિગ્રા થી ઉપર
બેડમીન્ટન	<input type="checkbox"/> સીંગલ્સ
બાસ્કેટબોલ	<input type="checkbox"/> બાસ્કેટબોલ
ટેબલ ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ
લોન ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ
હેન્ડબોલ	<input type="checkbox"/> હેન્ડબોલ
હોકી	<input type="checkbox"/> હોકી
કુટબોલ	<input type="checkbox"/> કુટબોલ
કરાટે	ભાઈઓ <input type="checkbox"/> ૩૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૩૫-૪૦ કિગ્રા <input type="checkbox"/> ૪૦-૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૫-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૫૮ કિગ્રા <input type="checkbox"/> ૫૮-૬૨ કિગ્રા <input type="checkbox"/> ૬૨-૬૬ કિગ્રા <input type="checkbox"/> ૬૬-૭૦ કિગ્રા <input type="checkbox"/> ૭૦-૭૪ કિગ્રા
	બહેનો <input type="checkbox"/> ૩૨ કિગ્રા સુધી <input type="checkbox"/> ૩૨-૩૬ કિગ્રા <input type="checkbox"/> ૩૬-૪૦ કિગ્રા <input type="checkbox"/> ૪૦-૪૪ કિગ્રા <input type="checkbox"/> ૪૪-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૨-૫૬ કિગ્રા <input type="checkbox"/> ૫૬-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦-૬૪ કિગ્રા <input type="checkbox"/> ૬૪-૬૮ કિગ્રા <input type="checkbox"/> ૬૮ થી ઉપર
રગ્બી	<input type="checkbox"/> રગ્બી

નોંધ:-યોગાસન માટે.

> ગ્રુપ-નપથિમોતાસન,સર્વોગાસન,મત્સ્યાસન,અર્ધમ-તોન્ડાસન,પુર્ણ ધનુરાસન, ઉતાન પાદાસન

> ગ્રુપ-બ પુર્ણ ચક્રાસન, કુકુડાસન, ભુમાસનપુર્ણ, સલભાસન, બકાસન,શિર્ષાસન

> ગ્રુપ- C સાંખ્યાસન, વ્યાધાસન, ઉર્ધ્વ કુકુડાસન, ઉત્તિશ્ચિતિવાસન, પદ્મ મયુરાસન,ઉત્તિશ્ચાહસ્તાસન

> રાજ્યકક્ષાએ બેસ્ટ ઓફ ધ બેસ્ટ રમાશે.

નોંધ:- શાળાકક્ષાથી રાજ્યકક્ષા સુધીની સ્પર્ધા માટે

> યોગાસનમાં ખેલાડી દ્વારા વધુમાં વધુ ૨ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.

> બે ઇવેન્ટમાં ભાગ લેવા માટે વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ ઇવેન્ટની પસંદગી કરવાની ફરજિયાત રહેશે.

> યોગાસનમાં ખેલાડી દ્વારા વધુમાં વધુ ૨ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.

> બે ઇવેન્ટમાં ભાગ લેવા માટે વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ ઇવેન્ટની પસંદગી કરવાની ફરજિયાત રહેશે.

> એથલેટિક્સ રમતમાં વધુ માં વધુ ૨ ઇવેન્ટ અને ૧ રીલે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.

> સ્વીમીંગ રમતમાં વધુમાં વધુ ૨ ઇવેન્ટ અને ૧ રીલેમાં ભાગ લઈ શકશે.

> જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ સ્કેટીંગમા કવોડ અથવા ઇનલાઈન વેમાંથી એક ઇવેન્ટમાં ભાગ લઈ શકશે

> કુસ્તી, ટેકવેન્ડો, બોક્સીંગ, કરાટે અને જુડોની રમતમાં કોઈ પણ એક વજન ગ્રુપમાં ભાગ લઈ શકશે.

❖ સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❖	
એથલેટીક્સ	<input type="checkbox"/> ૩૦૦૦ મી <input type="checkbox"/> ૧૦૦ મી હર્ડલ્સ (બહેનો) <input type="checkbox"/> ૧૧૦ મી હર્ડલ્સ (ભાઈઓ) <input type="checkbox"/> ૪ x ૧૦૦ મી રીલે <input type="checkbox"/> વાંસફૂદ <input type="checkbox"/> હથોડા ફેક <input type="checkbox"/> ૫ કી.મી.વોક(ભાઈઓ) <input type="checkbox"/> ૩ કી.મી.વોક(બહેનો) <input type="checkbox"/> ૪૦૦ મી હર્ડલ્સ
સ્વીમીંગ	<input type="checkbox"/> ફ્રીસ્ટાઇલ ૫૦મી <input type="checkbox"/> બેક સ્ટ્રોક ૨૦૦ મી <input type="checkbox"/> બ્રેસ્ટ સ્ટ્રોક ૨૦૦ મી <input type="checkbox"/> બટરફ્લાય સ્ટ્રોક ૨૦૦મી <input type="checkbox"/> ફ્રી સ્ટાઇલ ૮૦૦મી(ભાઈઓ) <input type="checkbox"/> વ્યક્તિગત મીડલ ૪૦૦ મી <input type="checkbox"/> ફ્રીસ્ટાઇલ ૨૦૦મી <input type="checkbox"/> બેક સ્ટ્રોક ૫૦મી <input type="checkbox"/> ફ્રીસ્ટાઇલ રીલે ૪ x ૧૦૦ મી <input type="checkbox"/> બ્રેસ્ટ સ્ટ્રોક ૫૦ મી <input type="checkbox"/> બટર ફ્લાય ૫૦મી <input type="checkbox"/> મીડલ રીલે ૪ x ૧૦૦ મી
જુડો	ભાઈઓ <input type="checkbox"/> ૬૦ કિગ્રાથી ઉપર અને -૬૬ કિગ્રા સુધી <input type="checkbox"/> ૬૬ કિગ્રાથી ઉપર અને -૭૩ કિગ્રા સુધી <input type="checkbox"/> ૭૩ કિગ્રાથી ઉપર અને -૮૧ કિગ્રા સુધી <input type="checkbox"/> ૮૧ કિગ્રાથી ઉપર અને -૯૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૯૦ કિગ્રાથી ઉપર બહેનો <input type="checkbox"/> ૫૨ કિગ્રાથી ઉપર અને -૫૭ કિગ્રા સુધી <input type="checkbox"/> ૫૭ કિગ્રાથી ઉપર અને -૬૩ કિગ્રા સુધી <input type="checkbox"/> ૬૩ કિગ્રાથી ઉપર અને -૭૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૭૦ કિગ્રાથી ઉપર
કુસ્તી	ભાઈઓ (ફ્રીસ્ટાઇલ) <input type="checkbox"/> ૬૦-૬૫ કિગ્રા <input type="checkbox"/> ૬૫-૭૧ કિગ્રા <input type="checkbox"/> ૭૧-૮૦ કિગ્રા <input type="checkbox"/> ૮૦-૯૨ કિગ્રા <input type="checkbox"/> ૯૨-૧૧૦ કિગ્રા બહેનો (ફ્રીસ્ટાઇલ) <input type="checkbox"/> ૫૩- ૫૭ કિગ્રા <input type="checkbox"/> ૫૭-૬૧ કિગ્રા <input type="checkbox"/> ૬૧-૬૫ કિગ્રા <input type="checkbox"/> ૬૫-૬૯ કિગ્રા <input type="checkbox"/> ૬૯-૭૩ કિગ્રા
ટેકવેન્ડો	ભાઈઓ <input type="checkbox"/> ૩૮-૪૧ કિગ્રા <input type="checkbox"/> ૪૧-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૫ કિગ્રા <input type="checkbox"/> ૫૫-૬૩ કિગ્રા <input type="checkbox"/> ૬૩-૬૮ કિગ્રા <input type="checkbox"/> ૬૮-૭૩ કિગ્રા <input type="checkbox"/> ૭૩-૭૮ કિગ્રા બહેનો <input type="checkbox"/> ૩૨-૩૫ કિગ્રા <input type="checkbox"/> ૩૫-૩૮ કિગ્રા <input type="checkbox"/> ૪૨-૪૪ કિગ્રા <input type="checkbox"/> ૪૬-૪૯ કિગ્રા <input type="checkbox"/> ૪૯-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૫-૫૯ કિગ્રા <input type="checkbox"/> ૫૯-૬૩ કિગ્રા <input type="checkbox"/> ૬૩-૬૮ કિગ્રા
જીમ્નાસ્ટીક	ભાઈઓ <input type="checkbox"/> ફ્લોર એક્સાઇઝ <input type="checkbox"/> વોલ્ટીંગ ટેબલ <input type="checkbox"/> રોમનરીંગ <input type="checkbox"/> પેરલબાર <input type="checkbox"/> પોમોલોજીસ <input type="checkbox"/> હોરિજોન્ટલબાર બહેનો <input type="checkbox"/> ફ્લોર એક્સાઇઝ <input type="checkbox"/> વોલ્ટીંગ ટેબલ <input type="checkbox"/> વેલેસીંગબીમ <input type="checkbox"/> અનઈવનબાર <input type="checkbox"/> હૂપ(રિધમીક) <input type="checkbox"/> ક્લબ(રિધમીક) <input type="checkbox"/> બોલ(રિધમીક) <input type="checkbox"/> રીબન (રિધમીક)
સ્કેટીંગ	કવોડ <input type="checkbox"/> રોડ રેસ ૩ (૩૦૦૦ મી.) ઈનલાઈન <input type="checkbox"/> રોડ રેસ ૨ (૫૦૦ મી.) <input type="checkbox"/> રોડ રેસ ૩ (૩૦૦૦ મી.)
આર્ચરી	રીકર્વ રાઉન્ડ <input type="checkbox"/> વ્યક્તિગત ઓવરશોટ <input type="checkbox"/> વ્યક્તિગત એલિમીનેશન રાઉન્ડ <input type="checkbox"/> ટીમ <input type="checkbox"/> મીક્સ ટીમ કમ્પાઉન્ડ રાઉન્ડ <input type="checkbox"/> વ્યક્તિગત ઓવરશોટ <input type="checkbox"/> વ્યક્તિગત એલિમીનેશન રાઉન્ડ <input type="checkbox"/> ટીમ <input type="checkbox"/> મીક્સ ટીમ
શુટીંગ	<input type="checkbox"/> ૧૦ મી.એર પીસ્તોલ <input type="checkbox"/> ૧૦ મી.પીપ સાઈટ એર રાયફલ <input type="checkbox"/> ૧૦ મી. ઓપન સાઈટ એર રાયફલ
વેઈટલીફ્ટીંગ	ભાઈઓ <input type="checkbox"/> ૪૯ કિગ્રા સુધી <input type="checkbox"/> ૫૫ કિગ્રા <input type="checkbox"/> ૬૧ કિગ્રા <input type="checkbox"/> ૬૭ કિગ્રા <input type="checkbox"/> ૭૩ કિગ્રા <input type="checkbox"/> ૮૧ કિગ્રા <input type="checkbox"/> ૮૯ કિગ્રા <input type="checkbox"/> ૯૬ કિગ્રા <input type="checkbox"/> ૧૦૨ કિગ્રા <input type="checkbox"/> ૧૦૨ કિગ્રા થી ઉપર બહેનો <input type="checkbox"/> ૪૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૯ કિગ્રા <input type="checkbox"/> ૫૫ કિગ્રા <input type="checkbox"/> ૬૧ કિગ્રા <input type="checkbox"/> ૬૭ કિગ્રા <input type="checkbox"/> ૭૩ કિગ્રા <input type="checkbox"/> ૮૧ કિગ્રા <input type="checkbox"/> ૮૧ કિગ્રા થી ઉપર
ફેન્સીંગ	<input type="checkbox"/> ફ્લોર <input type="checkbox"/> ઈપી <input type="checkbox"/> સેબર
બોક્સીંગ	ભાઈઓ <input type="checkbox"/> ૪૬ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૬-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૨-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૫૭ કિગ્રા <input type="checkbox"/> ૫૭-૬૦ કિગ્રા બહેનો <input type="checkbox"/> ૬૦-૬૩ કિગ્રા <input type="checkbox"/> ૬૩-૬૬ કિગ્રા <input type="checkbox"/> ૬૬-૭૦ કિગ્રા <input type="checkbox"/> ૭૦-૭૫ કિગ્રા <input type="checkbox"/> ૭૫-૮૦ કિગ્રા <input type="checkbox"/> ૮૦ કિગ્રાથી ઉપર <input type="checkbox"/> ૪૨ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૨-૪૪ કિગ્રા <input type="checkbox"/> ૪૪-૪૬ કિગ્રા <input type="checkbox"/> ૪૬-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૨-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૫૭ કિગ્રા <input type="checkbox"/> ૫૭-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦-૬૩ કિગ્રા <input type="checkbox"/> ૬૩-૬૬ કિગ્રા <input type="checkbox"/> ૬૬-૭૦ કિગ્રા <input type="checkbox"/> ૭૦-૭૫ કિગ્રા <input type="checkbox"/> ૭૫-૮૦ કિગ્રા <input type="checkbox"/> ૮૦ થી ઉપર
મલાખલ	<input type="checkbox"/> શેપ મલાખલ (ફક્ત બહેનો માટે) <input type="checkbox"/> પોલ મલાખલ (ફક્ત ભાઈઓ માટે)
રોલબોલ	<input type="checkbox"/> રોલબોલ
સેપક ટકરાવ	<input type="checkbox"/> રેગુ <input type="checkbox"/> કવોડસ
સ્પોર્ટ્સ ક્લબીંગ	<input type="checkbox"/> લીડ ક્લબીંગ <input type="checkbox"/> સ્પીડ ક્લબીંગ <input type="checkbox"/> બોલ્ડરીંગ
સોફ્ટ ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબ્લ્સ
ફેરવેલ	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબ્લ્સ <input type="checkbox"/> ટીમ
વુડબોલ	સ્કોક <input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબ્લ્સ <input type="checkbox"/> ટીમ

જીમ્નાસ્ટીક સ્પર્ધામાં ખેલાડી કોઈ પણ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે
જીમ્નાસ્ટીક સ્પર્ધામાના નિયમ પ્રમાણે ભાઈઓએ ૬ (છ) પેટા રમત અને બહેનોએ ૪ (ચાર) પેટા રમતમાં ભાગ લેવાનો રહેશે.

શુટીંગ સ્પર્ધામાં સ્પર્ધકોએ શુટીંગ માટે પોતાની સાઈફલ લાવવાની રહેશે.
ત્રણમાંથી કોઈ પણ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
શુટીંગ સ્પર્ધામાં એર પીસ્તોલની એક અથવા એર રાયફલ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે

ખેલ મહાકુંભ-૨૦૨૫

ઓપન એઈજ ગ્રુપ (તા.૦૧/૦૧/૧૯૨૬ અને તે પછી જન્મેલા)	
જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે <input checked="" type="checkbox"/> કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે.)	
❖ સીધી ગ્રામ્ય કક્ષાએથી શરૂ થતી સ્પર્ધા ❖	
એથલેટીક્સ	<input type="checkbox"/> ૧૦૦ મી. <input type="checkbox"/> લાંબીફૂદ <input type="checkbox"/> લંડાડીફાળ ફૂદ <input type="checkbox"/> ગોળાફૂક
રસ્સાખેંચ	<input type="checkbox"/> ભાઈઓ ૫૨૦ કિગ્રા <input type="checkbox"/> બહેનો ૪૪૦ કિગ્રા નોંધ: (૮ ખેલાડીઓનું કુલ વજન)
વોલીબોલ	<input type="checkbox"/> વોલીબોલ
કબડ્ડી	<input type="checkbox"/> ભાઈઓ (૮૫કિગ્રા) <input type="checkbox"/> બહેનો (૭૫કિગ્રા)
ખો-ખો	<input type="checkbox"/> ખો-ખો
❖ સીધી તાલુકા / ઝોનકક્ષાએથી શરૂ થતી સ્પર્ધા ❖	
એથલેટીક્સ	<input type="checkbox"/> ૨૦૦મી <input type="checkbox"/> ૪૦૦મી <input type="checkbox"/> ૮૦૦ મી <input type="checkbox"/> ૧૫૦૦ મી. <input type="checkbox"/> ૩૦૦૦ મી <input type="checkbox"/> ઉર્ચીકુદ <input type="checkbox"/> બરછીફૂક <input type="checkbox"/> ચક્રફૂક
ચેસ	<input type="checkbox"/> ચેસ
યોગાસન	<input type="checkbox"/> વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ (ગ્રુપ A, B, C અને મનપસંદગીના આસનો)
❖ સીધી જિલ્લા/કોર્પોરેશન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❖	
શુટીંગ બોલ	<input type="checkbox"/> ફક્ત ભાઈઓ માટે
બેડમીન્ટન	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબ્લ્સ <input type="checkbox"/> મિક્સ ડબ્લ્સ
યોગાસન	<input type="checkbox"/> આર્થિસ્ટિક યોગા(ટ્રેડિશનલ) <input type="checkbox"/> રિધમીક યોગા (નોંધ:- યોગાસનમાં ખેલાડી દ્વારા વધુમાં વધુ ૨ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.)
કુટબોલ	<input type="checkbox"/> કુટબોલ
બાસ્કેટબોલ	<input type="checkbox"/> બાસ્કેટબોલ
ટેબલ ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબ્લ્સ <input type="checkbox"/> મિક્સ ડબ્લ્સ
લોન ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબ્લ્સ <input type="checkbox"/> મિક્સ ડબ્લ્સ
હેન્ડબોલ	<input type="checkbox"/> હેન્ડબોલ
હોકી	<input type="checkbox"/> હોકી
સ્વીમીંગ	<input type="checkbox"/> ૧૦૦ મી.ફ્રી સ્ટાઇલ <input type="checkbox"/> બેક સ્ટ્રોક ૧૦૦ મી <input type="checkbox"/> બટર ફ્લાય સ્ટ્રોક ૧૦૦ મી. <input type="checkbox"/> ૪૦૦ મી.ફ્રી સ્ટાઇલ <input type="checkbox"/> બ્રેસ્ટ સ્ટ્રોક ૧૦૦ મી <input type="checkbox"/> વ્યક્તિગત મીડલ ૨૦૦ મી.
આર્ટીસ્ટીક સ્કેટીંગ	<input type="checkbox"/> ફ્રી સ્કેટીંગ <input type="checkbox"/> સોલોડાન્સ <input type="checkbox"/> ફીગર
સ્કેટીંગ	કવોડ <input type="checkbox"/> રીક ૧ (૫૦૦ મી.) <input type="checkbox"/> રીક ૨ (૧૦૦૦ મી.) ઈન લાઈન <input type="checkbox"/> રીક ૩ (૫૦૦ મી.) <input type="checkbox"/> રીક ૪ (૧૦૦૦ મી.)
જુડો	ભાઈઓ <input type="checkbox"/> ૫૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૫૫ કિગ્રાથી ઉપર અને -૬૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૬૦ કિગ્રાથી ઉપર અને -૬૬ કિગ્રા સુધી <input type="checkbox"/> ૬૬ કિગ્રાથી ઉપર અને -૭૩ કિગ્રા સુધી બહેનો <input type="checkbox"/> ૪૪ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૪ કિગ્રાથી ઉપર અને -૪૮ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૮ કિગ્રાથી ઉપર અને -૫૨ કિગ્રા સુધી <input type="checkbox"/> ૫૨ કિગ્રાથી ઉપર અને -૫૭ કિગ્રા સુધી
કુસ્તી	ભાઈઓ <input type="checkbox"/> ૪૬-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૬૫ કિગ્રા <input type="checkbox"/> ૬૫-૭૦ કિગ્રા <input type="checkbox"/> ૭૦-૭૪ કિગ્રા બહેનો <input type="checkbox"/> ૪૬-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૩ કિગ્રા <input type="checkbox"/> ૫૩-૫૫ કિગ્રા <input type="checkbox"/> ૫૫-૫૭ કિગ્રા <input type="checkbox"/> ૫૭-૬૧ કિગ્રા
ટેકવેન્ડો	ભાઈઓ <input type="checkbox"/> ૪૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૫-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૫૫-૫૮ કિગ્રા <input type="checkbox"/> ૬૮-૭૩ કિગ્રા બહેનો <input type="checkbox"/> ૪૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૫૨-૫૫ કિગ્રા <input type="checkbox"/> ૬૩-૬૮ કિગ્રા
આર્ચરી	<input type="checkbox"/> ઇન્ડિયન રાઉન્ડ (વ્યક્તિગત ઓવરશોટ)

નોંધ:- શાળાકક્ષાથી રાજ્યકક્ષા સુધીની સ્પર્ધા માટે
યોગાસનમાં ખેલાડી દ્વારા વધુમાં વધુ ૨ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
બે ઇવેન્ટમાં ભાગ લેવા માટે વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ ઇવેન્ટની પસંદગી કરવાની ફરજિયાત રહેશે.
એથલેટીક્સ રમતમાં વધુ માં વધુ ૨ ઇવેન્ટ અને ૧ રીલે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
સ્વીમીંગ રમતમાં વધુમાં વધુ ૩ ઇવેન્ટ અને ૨ રીલેમાં ભાગ લઈ શકશે.
જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ સ્કેટીંગમાં કવોડ અથવા ઇનલાઇન બેમાંથી એક ઇવેન્ટમાં ભાગ લઈ શકશે
કુસ્તી, ટેકવેન્ડો, બોક્સીંગ, કરાટે અને જુડોરમતમાં કોઈ પણ એક વજન ગ્રુપમાં ભાગ લઈ શકશે.
બેડમિન્ટન, ટેબલ ટેનીસ અને ટેનીસ રમતમાં ૩ ઇવેન્ટમાંથી કોઈ પણ ૨ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.

કરાટે	ભાઈઓ	<input type="checkbox"/> ૩૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૩૫-૪૦ કિગ્રા <input type="checkbox"/> ૪૦-૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૫-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૫૮ કિગ્રા <input type="checkbox"/> ૫૮-૬૨ કિગ્રા <input type="checkbox"/> ૬૨-૬૬ કિગ્રા <input type="checkbox"/> ૬૬-૭૦ કિગ્રા <input type="checkbox"/> ૭૦-૭૪ કિગ્રા
	બહેનો	<input type="checkbox"/> ૭૪-૭૮ કિગ્રા <input type="checkbox"/> ૭૮-૮૨ કિગ્રા <input type="checkbox"/> ૮૨ કિગ્રાથી ઉપર
૨૩મી	બહેનો	<input type="checkbox"/> ૩૨ કિગ્રા સુધી <input type="checkbox"/> ૩૨-૩૬ કિગ્રા <input type="checkbox"/> ૩૬-૪૦ કિગ્રા <input type="checkbox"/> ૪૦-૪૪ કિગ્રા <input type="checkbox"/> ૪૪-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૨-૫૬ કિગ્રા <input type="checkbox"/> ૫૬-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦-૬૪ કિગ્રા <input type="checkbox"/> ૬૪-૬૮ કિગ્રા <input type="checkbox"/> ૬૮ થી ઉપર
૨૩મી		
❖ સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❖		
એથલેટીક્સ		<input type="checkbox"/> ૫૦૦૦મી <input type="checkbox"/> ૧૧૦ મી હર્ડલ્સ ભાઈઓ <input type="checkbox"/> ૧૦૦ મી. હર્ડલ્સ(બહેનો) <input type="checkbox"/> ૪૦૦મી હર્ડલ્સ <input type="checkbox"/> ૪ x ૧૦૦મી. રીલે <input type="checkbox"/> ૪ x ૪૦૦ મી. રીલે <input type="checkbox"/> વાંસફા <input type="checkbox"/> હથોડા ફેક
સ્વીમીંગ		<input type="checkbox"/> ફ્રી સ્ટાઈલ ૫૦મી <input type="checkbox"/> ફ્રી સ્ટાઈલ ૨૦૦મી <input type="checkbox"/> ફ્રી સ્ટાઈલ ૮૦૦મી બહેનો <input type="checkbox"/> ફ્રીસ્ટાઈલ ૧૫૦૦ મી ભાઈઓ <input type="checkbox"/> ફ્રીસ્ટાઈલ રીલે ૪ x ૧૦૦મી.
		<input type="checkbox"/> બ્રેસ્ટ સ્ટ્રોક ૫૦ મી <input type="checkbox"/> બેક સ્ટ્રોક ૨૦૦ મી <input type="checkbox"/> બટર ફ્લાય ૫૦મી <input type="checkbox"/> બટર ફ્લાય સ્ટ્રોક ૨૦૦ મી
		<input type="checkbox"/> બેક સ્ટ્રોક ૫૦ મી <input type="checkbox"/> બ્રેસ્ટ સ્ટ્રોક ૨૦૦ મી <input type="checkbox"/> મીડલે રીલે ૪ x ૧૦૦મી <input type="checkbox"/> વ્યક્તિગત મીડલે ૪૦૦ મી
જુડો	ભાઈઓ	<input type="checkbox"/> ૭૩ કિગ્રાથી ઉપર અને -૮૧ કિગ્રા સુધી <input type="checkbox"/> ૮૧ કિગ્રાથી ઉપર અને -૯૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૯૦ કિગ્રાથી ઉપર અને -૧૦૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૧૦૦ કિગ્રાથી ઉપર
	બહેનો	<input type="checkbox"/> ૫૭ કિગ્રાથી ઉપર અને -૬૩ કિગ્રા સુધી <input type="checkbox"/> ૬૩ કિગ્રાથી ઉપર અને -૭૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૭૦ કિગ્રાથી ઉપર અને -૭૮ કિગ્રા સુધી <input type="checkbox"/> ૭૮ કિગ્રાથી ઉપર
કુસ્તી	ભાઈઓ	<input type="checkbox"/> ૭૪-૭૮ કિગ્રા <input type="checkbox"/> ૭૯-૮૬ કિગ્રા <input type="checkbox"/> ૮૬-૯૨ કિગ્રા <input type="checkbox"/> ૯૨-૯૭ કિગ્રા <input type="checkbox"/> ૯૭-૧૨૫ કિગ્રા
	બહેનો	<input type="checkbox"/> ૫૯-૬૨ કિગ્રા <input type="checkbox"/> ૬૨-૬૫ કિગ્રા <input type="checkbox"/> ૬૫-૬૮ કિગ્રા <input type="checkbox"/> ૬૮-૭૨ કિગ્રા <input type="checkbox"/> ૭૨-૭૬ કિગ્રા
ટેકવોન્ડો	ભાઈઓ	<input type="checkbox"/> ૪૮-૫૧ કિગ્રા <input type="checkbox"/> ૫૧-૫૫ કિગ્રા <input type="checkbox"/> ૫૯-૬૩ કિગ્રા <input type="checkbox"/> ૬૩-૬૭ કિગ્રા <input type="checkbox"/> ૭૩-૭૮ કિગ્રા <input type="checkbox"/> ૭૮ કિગ્રાથી ઉપર
	બહેનો	<input type="checkbox"/> ૪૦-૪૨ કિગ્રા <input type="checkbox"/> ૪૨-૪૪ કિગ્રા <input type="checkbox"/> ૪૪-૪૬ કિગ્રા <input type="checkbox"/> ૪૬-૪૯ કિગ્રા <input type="checkbox"/> ૪૯-૫૨ કિગ્રા
આર્ચરી		રીકર્વ રાઉન્ડ <input type="checkbox"/> વ્યક્તિગત ઓવરચોલ <input type="checkbox"/> વ્યક્તિગત એલિમીનેશન રાઉન્ડ <input type="checkbox"/> ટીમ <input type="checkbox"/> મીક્સ ટીમ
		કમ્પાઉન્ડ રાઉન્ડ <input type="checkbox"/> વ્યક્તિગત ઓવરચોલ <input type="checkbox"/> વ્યક્તિગત એલિમીનેશન રાઉન્ડ <input type="checkbox"/> ટીમ <input type="checkbox"/> મીક્સ ટીમ
જીમ્નાસ્ટીક	ભાઈઓ	<input type="checkbox"/> ફ્લોર એક્સાઈઝ <input type="checkbox"/> વોલ્ટીંગ ટેબલ <input type="checkbox"/> શેમનરીંગ <input type="checkbox"/> પેરલલબાર <input type="checkbox"/> પોમેલહોર્સ <input type="checkbox"/> શેરિજોટલબાર
	બહેનો	<input type="checkbox"/> ફ્લોર એક્સાઈઝ <input type="checkbox"/> વોલ્ટીંગ ટેબલ <input type="checkbox"/> બેલેસીંગબીમ <input type="checkbox"/> અન ઈવનબાર <input type="checkbox"/> હૂપ(રિધમીક) <input type="checkbox"/> ક્લબ(રિધમીક) <input type="checkbox"/> બોલ(રિધમીક) <input type="checkbox"/> રીબન (રિધમીક)
સ્કેટીંગ	કવોડ	<input type="checkbox"/> રોડ ૧ (૩૦૦૦ મી.)
	ઈન લાઈન	<input type="checkbox"/> રોડ ૨ (૫૦૦ મી.) <input type="checkbox"/> રોડ ૩ (૩૦૦૦ મી.)
સાઈકલિંગ		
શુટીંગ	રાઈફલ ગ્રુપ	<input type="checkbox"/> ૧૦ મી. એર રાયફલ પીપ <input type="checkbox"/> ૫૦ મી. ૦.૨૨ રાઈફલ ૩ પોજિશન
	પિસ્તોલ ગ્રુપ	<input type="checkbox"/> ૧૦ મી. એર પિસ્તોલ <input type="checkbox"/> ૦.૨૨ રેપીડ ફાયર (ભાઈઓ) <input type="checkbox"/> ૦.૨૨ સ્પોર્ટ્સ પિસ્તોલ (બહેનો)
	ટ્રેપ ગ્રુપ	<input type="checkbox"/> શોટગન ટ્રેપ <input type="checkbox"/> શોટગન ડબલ ટ્રેપ
વેઈટલીફ્ટીંગ	ભાઈઓ	<input type="checkbox"/> ૫૫ કિગ્રા <input type="checkbox"/> ૬૧ કિગ્રા <input type="checkbox"/> ૬૭ કિગ્રા <input type="checkbox"/> ૭૩ કિગ્રા <input type="checkbox"/> ૮૧ કિગ્રા <input type="checkbox"/> ૮૯ કિગ્રા <input type="checkbox"/> ૯૬ કિગ્રા <input type="checkbox"/> ૧૦૨ કિગ્રા <input type="checkbox"/> ૧૦૯ કિગ્રા <input type="checkbox"/> ૧૧૬ કિગ્રા થી ઉપર
	બહેનો	<input type="checkbox"/> ૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૯ કિગ્રા <input type="checkbox"/> ૫૫ કિગ્રા <input type="checkbox"/> ૫૯ કિગ્રા <input type="checkbox"/> ૬૪ કિગ્રા <input type="checkbox"/> ૭૧ કિગ્રા <input type="checkbox"/> ૭૬ કિગ્રા <input type="checkbox"/> ૮૧ કિગ્રા <input type="checkbox"/> ૮૭ કિગ્રા <input type="checkbox"/> ૯૩ કિગ્રા થી ઉપર
ક્રેન્સીંગ		
બોક્સીંગ	ભાઈઓ	<input type="checkbox"/> ૪૬-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૧ કિગ્રા <input type="checkbox"/> ૫૧-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૫૭ કિગ્રા <input type="checkbox"/> ૫૭-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦-૬૩.૫ કિગ્રા <input type="checkbox"/> ૬૩.૫-૬૭ કિગ્રા <input type="checkbox"/> ૬૭-૭૧ કિગ્રા <input type="checkbox"/> ૭૧-૭૫ કિગ્રા <input type="checkbox"/> ૭૫-૮૦ કિગ્રા
	બહેનો	<input type="checkbox"/> ૪૫-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૨-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૫૭ કિગ્રા <input type="checkbox"/> ૫૭-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦-૬૩ કિગ્રા <input type="checkbox"/> ૬૩-૬૬ કિગ્રા <input type="checkbox"/> ૬૬-૭૦ કિગ્રા <input type="checkbox"/> ૭૦-૭૫ કિગ્રા
બીચ હેન્ડબોલ		
બીચ વોલીબોલ		
થ્રોડેસવારી		
મલાખંસ		
સોકર ટેનીસ		
સ્પોર્ટ્સ ક્લામીંગ		
વુડબોલ	ફેરપલે	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબલ્સ <input type="checkbox"/> ટીમ
	સ્ટ્રોક	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબલ્સ <input type="checkbox"/> ટીમ

➤ જીમ્નાસ્ટીક સ્પર્ધામાં ખેલાડી કોઈ પણ બે ઈવેન્ટમાં ભાગ લઈ શકશે

➤ શુટીંગ સ્પર્ધામાં સ્પર્ધકોએ શુટીંગ માટે પોતાની રાઈફલ લાવવાની રહેશે.

➤ બધી જ સ્પર્ધાઓ ઈન્ટર નેશનલ શુટીંગ સ્પોર્ટ્સ ફેડરેશન (ISSF)ના નિયમો મુજબ યોજાશે

➤ શુટીંગ સ્પર્ધામાં રાઈફલ અથવા પિસ્તોલ અને ટ્રેપ ગ્રુપમાં કોઈપણ બે ઈવેન્ટમાં ભાગ લઈ શકશે

બેલ મહાકુંભ-૨૦૨૫

૪૦ વર્ષથી ઉપર (તા.૦૧/૦૧/૧૯૮૬ થી તા.૩૧/૧૨/૧૯૮૫ દરમ્યાન જન્મેલા)

જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે.)

❖ સીધી ગ્રામ્યકક્ષાએથી શરૂ થતી સ્પર્ધા ❖

રસ્સાખેંચ ભાઈઓ ૫૬૦ કિગ્રા બહેનો ૪૮૦ કિગ્રાનોંધ: (૮ ખેલાડીઓનું કુલ વજન)

❖ સીધી તાલુકા/ઝોનકક્ષાએથી શરૂ થતી સ્પર્ધા ❖

ચેસ ચેસ

નોંધ:- અબોવ-૪૦ અને અબોવ-૬૦ માટે બેડમિન્ટન, ટેબલ ટેનીસ અને ટેનીસ રમતમાં ૩ ઈવેન્ટમાંથી કોઈ પણ ૨ ઈવેન્ટમાં ભાગ લઈ શકશે.

❖ સીધી જિલ્લા/કોર્પોરેશન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❖

શુટીંગ બોલ	<input type="checkbox"/> ફક્ત ભાઈઓ માટે
બેડમીન્ટન	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબલ્સ <input type="checkbox"/> મિક્સ ડબલ્સ
ટેબલ ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબલ્સ <input type="checkbox"/> મિક્સ ડબલ્સ
લોન ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબલ્સ <input type="checkbox"/> મિક્સ ડબલ્સ
સ્વીમીંગ	<input type="checkbox"/> ૫૦ મી.ફ્રી સ્ટાઈલ <input type="checkbox"/> ૧૦૦ મી.ફ્રી સ્ટાઈલ <input type="checkbox"/> ૫૦ મી બેક સ્ટ્રોક <input type="checkbox"/> ૫૦ મી બ્રેસ્ટ સ્ટ્રોક <input type="checkbox"/> ૫૦મી.બટર ફ્લાય સ્ટ્રોક
સ્વીમીંગ રમતમાં કોઈપણ ૩ ઈવેન્ટમાં ભાગ લઈ શકશે.	

નોંધ:-યોગાસન માટે (રાજ્યકક્ષા)

અબોવ-૪૦ માં માત્ર એક જ ઈવેન્ટમાં ભાગ લઈ શકશે.

➤ આગળ જુકવાનું આસન:- પશ્ચિમોતાસન, ભુમાસન, ઉત્થિતપાદઆસન, કુર્મોસન, યોગાસન

➤ પાછળ જુકવાનું આસન:- ચકાસન, ધનુરાસન, ઉષ્ટ્રાસન, ભુજગાસન, સેતુબંધારાસન

➤ કમળને વળાંક આપનું આસન:-પૂર્ણમત્તેન્દ્રઆસન, કમરમરોડાસન, વકાસન, હાથનું સમતુલન આસન, પગનું સમતુલન આસન

❏ સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❏	
યોગાસન	<input type="checkbox"/> કોમ્બીનેશન યોગ ચેમ્પીયન શીપ

50 વર્ષથી ઉપર (તા.૩૧/૧૨/૧૯૬૫ અને તે પહેલા જન્મેલા)

જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે	<input checked="" type="checkbox"/>	કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે.)
------------------------------------	-------------------------------------	---------------------------------

❏ સીધી ગ્રામ્યકક્ષાએથી શરૂ થતી સ્પર્ધા ❏

રસ્સાખેંચ	<input type="checkbox"/> ભાઈઓ ૬૨૦ કિગ્રા <input type="checkbox"/> બહેનો ૪૮૦ કિગ્રા નોંધ: (૮ ખેલાડીઓનું કુલ વજન)
-----------	---

❏ સીધી તાલુકા / ઝોન કક્ષાએથી શરૂ થતી સ્પર્ધા ❏

ચેસ	<input type="checkbox"/> ચેસ
-----	------------------------------

❏ સીધી જિલ્લા/કોર્પોરેશન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❏

બેડમીન્ટન	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબ્લ્સ <input type="checkbox"/> મિક્સ ડબ્લ્સ	નોંધ: યોગાસન માટે (રાજ્યકક્ષા) અબોવ-૬૦ માં માત્ર એક જ ઇવેન્ટમાં ભાગ લઈ શકાશે. ૫ આસનો કરવાના રહેશે. આગળ જુકવાનું આસન, પાછળ જુકવાનું આસન, કમળને વળાંક આપતું આસન, હાથનું સમતુલન આસન, પગનું સમતુલન આસન
ટેબલ ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબ્લ્સ <input type="checkbox"/> મિક્સ ડબ્લ્સ	
લોન ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબ્લ્સ <input type="checkbox"/> મિક્સ ડબ્લ્સ	
સ્વીમીંગ	<input type="checkbox"/> ૫૦ મી. ફ્રી સ્ટાઇલ <input type="checkbox"/> ૧૦૦ મી. ફ્રી સ્ટાઇલ <input type="checkbox"/> ૫૦ મી બેક સ્ટ્રોક	સ્વીમીંગ રમતમાં કોઇપણ ૩ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
	<input type="checkbox"/> ૫૦ મી બ્રેસ્ટ સ્ટ્રોક <input type="checkbox"/> ૫૦ મી. બટર ફ્લાય સ્ટ્રોક	

❏ સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❏

યોગાસન	<input type="checkbox"/> કોમ્બીનેશન યોગ ચેમ્પીયન શીપ
--------	--